

ત્વરિત જાહેરાત માટે

બ્રમ્પટન COVID-19ની કટોકટી દરમિયાન વધુ તબીબો રાખવાની ક્ષમતા માટે વિનંતી કરે છે

બ્રમ્પટન, ઓન્ટારિયો (08 એપ્રિલ 2020) – આજની બેઠકમાં બ્રમ્પટન સિટી કાઉન્સિલે COVID-19 ની કટોકટી દરમિયાન ફ્રન્ટલાઈન પર કાર્ય કરવાની વિનંતીના ઉપલક્ષમાં પાત્રતા ધરાવતા વિદેશમાં પ્રશિક્ષિત ડોક્ટરોને સમર્થન આપવાની સૂચનાને મંજૂરી આપી હતી જેથી સ્થાનિક આરોગ્યસંભાળ ક્ષમતામાં વધારો કરવામાં મદદ મળી શકે.

મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown) અને કાઉન્સિલર શેરમેન વિલિયમ્સ (Charmaine Williams) દ્વારા પ્રોવિન્સને લખાયેલ પત્રોનું સિટી કાઉન્સિલે અનુમોદન કર્યું હતું. સિટી, કાઉન્સિલની દરખાસ્ત આખા ઓન્ટારિયોની સુધરાઈઓ અને ટાઉનશિપ્સને વહેંચશે અને સાથે જ વિનંતી કરશે કે તેઓ પણ ઓન્ટારિયોના આરોગ્ય મંત્રી તેમજ ઓન્ટારિયોના પ્રમુખને પોતાના પત્રો આ પગલાંના સમર્થનરૂપે મોકલે.

કાઉન્સિલ ઓન્ટારિયો સરકાર દ્વારા કરાયેલ ગઈકાલની જાહેરાતનું સ્વાગત કરે છે જેમાં તેમના નવા ઓનલાઈન ટૂલ વિશે જણાવાયું છે જે નિયોકતાઓ સાથે વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા ફ્રન્ટલાઈન કાર્યકરોને મેચ કરે છે અને તેઓ સ્વીકારે છે કે COVID-19 સામેની લડતમાં આ એક અતિમહત્વપૂર્ણ પગલું ગણાય.

24 માર્ચ 2020ના રોજ સિટી કાઉન્સિલ સાથે સલાહમસલત કર્યા બાદ અને સિટીની ઈમર્જન્સી મેનેજમેન્ટ ટીમની ભલામણને ધ્યાન પર લઈને મેયર પેટ્રિક બ્રાઉને સિટીના ઈમર્જન્સી મેનેજમેન્ટ પ્લાન અનુસાર સિટી ઓફ બ્રમ્પટનમાં કટોકટીની સ્થિતિની ઘોષણા કરેલ છે. ત્યારથી, સિટીએ ઝડપી અને અભૂતપૂર્વ પગલાં લેવાનું ચાલુ રાખ્યું છે જેથી સમાજના આરોગ્ય અને સલામતીનું રક્ષણ કરી શકાય.

લિંક:

- [24 માર્ચ 2020– સિટી ઓફ બ્રમ્પટન COVID-19નો સામનો કરવા માટે કટોકટીની સ્થિતિ જાહેર કરે છે.](#)
- [07 એપ્રિલ 2020– સિટી ઓફ બ્રમ્પટન COVID-19 સામેની લડત વિષયક અપડેટ.](#)

અવતરણો

“આખા પ્રોવિન્સમાં તેમજ બ્રમ્પટનમાં, હજારોની સંખ્યામાં વિદેશમાં પ્રશિક્ષિત લોય એવા ડોક્ટરો અને નર્સો છે જેઓ COVID-19 કટોકટીના કાળમાં ફ્રન્ટલાઈનમાં ટેકો આપવા તૈયાર છે અને મદદ કરવાની ઈચ્છા રાખે છે. દરરોજ જ્યારે કન્ફર્મ થયેલા કેસની સંખ્યા વધતી જાય છે ત્યારે આપણને આવી પ્રતિભાઓનો સદુપયોગ ન કરવો પરવડે તેમ નથી – આ તો જીવ બચાવવાની બાબત છે.”

- પેટ્રિક બ્રાઉન, મેયર, સિટી ઓફ બ્રમ્પટન

"આ ઉદ્દેશ માટે બ્રમ્પટને આગેવાની લીધી છે. હવે અમે ઓન્ટારિયોના અન્ય શહેરો અને નગરોને અમારી સાથે જોડાવા આલ્પવાન આપી રહ્યા છીએ. આરોગ્યસંભાળ વ્યવસાયિકો જેઓ આ મહામારી સામે લડત આપવા માટે રોજ આગળ આવી રહ્યા છે તેઓને માત્ર આપણી પ્રશંસા જ નહીં પરંતુ આપણી મદદની પણ જરૂર છે. આવા કાર્યકરોને તેઓને જોઈએ છે એવો ટેકો પાત્રતા ધરાવતા, વિદેશમાં પ્રશિક્ષિત ડોક્ટરોને તેઓની સાથે મોખરે એટલેકે ફ્રન્ટલાઈનમાં જોડાવાની મંજૂરી આપીને જ આપી શકીશું નહીં કે માત્ર સાર્થકલાઈનમાં."

- **શેરમેન વિલિયમ્સ (Charmaine Williams)** સીટી કાઉન્સિલર, વોર્ડ 7 અને 8, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca